



ક્રમ નંબર: 111

Aqiqe Ke Baare Mein Suwal Jawab (Gujarati)

# અકીકે કે બારે મેં સુવાલ જવાબ



શૈબે તરીકત, અમીરે અહલે સુન્નત. બાનિયે દા'વતે ઇસ્લામી. હાસ્ત અલ્લામા મૌલાના અબૂ ઝિયાલ

મુહમ્મદ ઇલ્યાસ અત્તાર કાદિરી ર-ઝવી کاتبہ برکتہ  
العالیہ

الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ  
أَمَّا بَعْدُ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

## किताब पढने की दुआ

अज : शैभे तरीकत, अभीरे अहले सुन्नत, भानिये दा'वते इस्लामी, हजरत अल्लामा मौलाना अबू बिलाल मुहम्मद इल्यास अतार कादिरि र-जवी دَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَهُ  
दीनी किताब या इस्लामी सबक पढने से पहले जैल में दी हुई दुआ पढ लीजिये اِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ जो कुछ पढ़ेंगे याद रहेगा. दुआ येह है :

اللَّهُمَّ افْتَحْ عَلَيْنَا حِكْمَتَكَ وَأَنْشُرْ  
عَلَيْنَا رَحْمَتَكَ يَا ذَا الْجَلَالِ وَالْإِكْرَامِ

तरजमा : ओ अल्लाह! हम पर इल्मो हिकमत के दरवाजे खोल दे और हम पर अपनी रहमत नाज़िल फ़रमा ! ओ अ-जमत और बुख़र्गी वाले । (المستطرف ج ١ ص ٤٠٤ دار الفكر بيروت)  
नोट : अव्वल आबिर अक अक बार दुइद शरीफ़ पढ लीजिये.

तालिबे गमे मदीना

व बकीअ

व मज्फ़िरत

13 शव्वालुल मुकर्रम 1428 हि.



## अकीके के बारे में सुवाल जवाब

येह रिसाला (अकीके के बारे में सुवाल जवाब)

शैभे तरीकत, अभीरे अहले सुन्नत, भानिये दा'वते इस्लामी हजरत अल्लामा मौलाना अबू बिलाल मुहम्मद इल्यास अतार कादिरि र-जवी जियाई دَامَتْ بَرَكَاتُهُمُ الْعَالِيَهُ ने उर्दू ज़बान में तहरीर फ़रमाया है.

मजलिसे तराजिम (दा'वते इस्लामी) ने इस रिसाले को गुजराती रस्मुल पत में तरतीब दे कर पेश किया है और मक-त-बतुल मदीना से शाअेअ करवाया है. इस में अगर किसी जगह कमी बेशी पाअें तो मजलिसे तराजिम को (ब जरीअअे मक्तूब, ई-मेल या SMS) मुत्तलअ फ़रमा कर सवाब कमाईये.

राबिता : मजलिसे तराजिम (दा'वते इस्लामी)

मक-त-बतुल मदीना, सिलेकटेड हाउस, अलिफ़ की मस्जिद के सामने,

तीन दरवाज़ा, अहमदशाबाह-1, गुजरात

MO. 9374031409 • E-mail : translationmaktabhind@dawateislami.net



الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ وَالصَّلَاةُ وَالسَّلَامُ عَلَى سَيِّدِ الْمُرْسَلِينَ  
أَمَّا بَعْدُ فَأَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

## अकीके के बारे में सुवाल जवाब

शैतान लाभ सुस्ती दिलाये सिर्फ (23 सफ़ात) पर मुश्तमिल येह रिसाला मुकम्मल पढ लीजिये **إِنْ شَاءَ اللَّهُ عَزَّوَجَلَّ** मा'लूमात का अनमोल भजाना हाथ आयेगा.

### दुइए शरीफ़ की इज़ीलत

उज़रते सय्यिदुना अबू दरदा **رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهُ** से रिवायत है के शकीउल मुज़िनबीन, रइमतुख़िल आ-लमीन **صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** का षशदि दिल् नशीन है : जिस ने मुज़ पर दस मर्तबा सुब्ह और दस मर्तबा शाम दुइए पाक पढा उसे क्रियामत के दिन मेरी शफ़ाअत मिलेगी.

(مَجْمَعُ الرُّوَايَاتِ ج ١٠ ص ١٦٣ احديث ١٧٠٢٢)

صَلُّوا عَلَيَّ الْحَبِيبِ! صَلَّى اللَّهُ تَعَالَى عَلَيَّ مُحَمَّدٍ

### अकीका के मा'ना

**सुवाल 1** अकीका के क्या मा'ना हैं ?

**जवाब** अकीका का लइज़ी मा'ना : अकीका भना है **عَقْتُ** से भ मा'ना

ફરમાને મુસ્તફા ﷺ : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : જો શખ્સ મુઝ પર દુરૂદ પાક પઢના ભૂલ ગયા વોહ જન્મત કા રાસ્તા ભૂલ ગયા. (ખૂરાન)

કાટના, અલગ કરના. (મિરઆત, જિ. 6, સ. 2)

અકીકા કે શર-ઈ મા'ના : બચ્યા પૈદા હોને કે શુક્રિયા મેં જો જાનવર ઝબ્હ ક્રિયા જાતા હૈં ઉસ કો અકીકા કહતે હૈં.

(બહારે શરીઅત, જિ. 3, સ. 355)

સુવાલ 2

જવાબ

અકીકા કરને મેં ક્યા ક્યા અચ્છી નિચ્યતેં કરની ચાહિએં ?

બચ્યા/બચ્ચી કી વિલાદત કી મસરત પર બતૌરે શુકે ને'મત અદાએ સુન્નત કે લિયે અલ્લાહ عَزَّوَجَلَّ કી રિઝા કી ખાતિર અકીકે કી સઆદત હાસિલ કરતા હું. ઈસ કે ઈલાવા ભી હસ્બે હાલ નિચ્યતેં કી જા સકતી હૈં. યાદ રહે ! બિગૈર અચ્છી નિચ્યત કે અ-મલે ખૈર કા સવાબ નહીં મિલતા. ઝાહિર યેહી હૈં કે અકીકા કરતે વક્ત કરને વાલે કે દિલ મેં નિચ્યતે અકીકા હોતી હોગી તાહમ જિતની અચ્છી અચ્છી નિચ્યતેં ઝિયાદા ઉતના સવાબ ભી ઝિયાદા. ફરમાને મુસ્તફા ﷺ : “مُسْلِمَانُ كَيْفَ يُؤْتَى بِخَيْرٍ مِنْ عَمَلِهِ هَيْ صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ كَيْفَ يُؤْتَى بِخَيْرٍ مِنْ عَمَلِهِ هَيْ صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ” “મુસલમાન કી નિચ્યત ઉસ કે અમલ સે બેહતર હૈં.”

(الْمُعْجَمُ الْكَبِيرُ لِلطَّبْرَانِيِّ ج ٦ ص ١٨٥ حديث ٥٩٤٢)

ક્યા અકીકા ન કરના ગુનાહ હૈ ?

સુવાલ 3

જવાબ

ક્યા “અકીકા” ન કરને વાલા ગુનહગાર હોતા હૈ ?

અકીકા ફર્જ યા વાજિબ નહીં હૈં સિફ સુન્નતે મુસ્તહબ્બા હૈ, તર્ક કરના ગુનાહ નહીં. (અગર ગુન્જાઈશ હો તો ઝરૂર કરના ચાહિયે, ન કરે તો ગુનાહ નહીં અલબત્તા અકીકે કે સવાબ સે મહરૂમી હૈ) ગરીબ આદમી કો હરગિઝ જાઈઝ નહીં કે સૂદી કર્ઝા લે કર અકીકા કરે. (માખૂઝ અઝ ઈસ્લામી ઝિન્દગી, સ. 27)

करमाने मुस्तफ़ा صَلَّی اللہُ تَعَالٰی عَلَیْہِ وَاٰلِہٖ وَسَلَّمَ : जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुर्रद पाक न पढा तलकीक वोह बढ भप्त हो गया. (उः)

## बे अकीका मरने वाला बय्या शफ़ाअत करेगा या नहीं ?

### सुवाल 4

क्या येह दुरुस्त है के जो बय्या बिगैर अकीका इन्तिकाल कर गया वोह अपने वालिदैन की शफ़ाअत नहीं करेगा ?

### जवाब

जो हां ! मगर इस की सूरतें हैं : जिस बय्ये ने अकीके का वक्त पाया या'नी वोह बय्या सात दिन का हो गया और बिला उजर जब के इस्तिताअत (या'नी ताकत) भी हो उस का अकीका न किया गया तो वोह अपने मां बाप की शफ़ाअत न करेगा. उदीसे पाक में है के **الْغُلَامُ مُرْتَهَنٌ بِعَقِيْبَتِهِ** या'नी "लडका अपने अकीके में गिरवी है." (तर्मिडी ج ३ ص १७७ حدیث १०२७) **अशिअ-अतुल्लम्मात** में है, इमाम अहमद عَلَيْهِ رَحْمَةُ اللّٰهِ تَعَالٰی عَلَيْهِ इरमाते हैं : "बय्ये का जब तक अकीका न किया जाये उस को वालिदैन के हक में शफ़ाअत करने से रोक दिया जाता है." (اشعة الممتع ج ३ ص ०१२) सदरुशशरीअह, अदरुतरीकह, उजरते अल्लामा मौलाना मुफ़्ती मुहम्मद अमजद अली आ'जमी عَلَيْهِ رَحْمَةُ اللّٰهِ تَعَالٰی मजकूरा उदीसे पाक के तहत इरमाते हैं : "गिरवी" होने का मतलब येह है के उस से पूरा नफ़अ हासिल न होगा जब तक अकीका न किया जाये और बा'ज (मुहदिसीन) ने कडा बय्ये की सलामती और उस की नश्वो नुमा (इलना इलना) और उस में अय्ये औसाइ (या'नी उम्दा पूबियां) होना अकीके के साथ वाबस्ता है. (बहारे शरीअत, जि. 3, स. 354)

### सुवाल 5

जिस का "अकीका" न हुआ क्या वोह जवान्नी में अपना अकीका कर सकता है ?

करमाने मुस्तक। صلى الله تعالى عليه وآله وسلم : जिस ने मुज पर दस भरतभा सुब्द और दस भरतभा शाम दुइटे पाक पढा।  
 उसे क्रियामत के दिन मेरी शक्राअत मिलेगी. (अबुअरुफ)

**जवाब**

जो हां ! जिस का अकीका न हुवा हो वोह जवानी, बुढापे में भी अपना अकीका कर सकता है (इतावा र-अविय्या, जि. 20, स. 588) जैसा के रसूलुल्लाह صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ने ओ'लाने नुबुव्वत के भा'द जुद अपना अकीका किया।

(مصنّف عبد الرزاق ج ٤ ص ٢٥٤ حديث ٢١٧٤)

## कय्या हम्ल गिर जाने की इमीलत

**सुवाल 6**

कया हम्ल गिर जाने की सूरत में अकीका करना होगा ?

**जवाब**

नहीं. कय्या हम्ल गिर जाने के सबब उमूमन मां बाप बहुत परेशान हो जाते हैं. उन की तसल्ली के लिये अर्ज है के जैसे मौकअ पर सभ्र कर के अज कमाना याहिये. कय्या हम्ल गिर जाने में मां बाप का बहुत बडा बहुत ही बडा फ़ाअेदा है. युनान्ये, अल्लाह عَزَّوَجَلَّ के हबीब, हबीबे लबीब صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ने ईशाद इरमाया : बेशक कय्या बय्या (या'नी मां के पेट से ना मुकम्मल गिर जाने वाला) अपने रब عَزَّوَجَلَّ से (उस वक्त) जगडेगा जब के उस के वालिदैन (जिन का ईमान पर आतिमा हुवा होगा मगर शामते आ'माल के सबब उन) को अल्लाह तआला दोऊभ में दाखिल इरमायेगा, हुकम होगा : औ अपने रब عَزَّوَجَلَّ से जगडने वाले बय्ये ! अपने मां बाप को जन्नत में ले जा, लिहाजा वोह अपनी नाल<sup>1</sup> से दोनों<sup>2</sup> को भीयेगा यहां तक के उन्हें जन्नत में ले जायेगा. (अबुअरुफ)

(ابن ماجه ج ٢ ص ٢٧٣ حديث ١٦٠٨) भीठे भीठे ईस्लामी भाईयो ! ईस

रिवायत से ईमान की सलामती की अहम्मियत भी

دينه

1 : या'नी वोह आंत जो रेड्मे मादर में बय्ये के पेट से जुडी होती है और जिसे पैदाईश पर काट कर जुदा कर देते हैं.

ફરમાને મુસ્તફા ﷺ : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस के पास मेरा ठिक डुवा और उस ने मुज पर दुइद शरीफ न पढा उस ने जफा की. (عباراتی)

ઉજાગર હુઈ કે શફાઅત કી ને'મત પાને કે લિયે ઈમાન કા સલામત હોના લાઝિમી હૈ લિહાઝા હર એક કો અપને ઈમાન કી સલામતી કી ફિક કરની યાહિયે. યકીનન ઈમાન કી સલામતી અલ્લાહ ﷻ કી રિઝા મેં પોશીદા હૈ ઓર અલ્લાહ ﷻ કી રિઝા ઉસ કી ઓર ઉસ કે હબીબ ﷺ કી ઓર ઉસ કે હબીબ ﷺ કી ફરમાં બરદારી મેં હૈ ઓર ઈમાન કી બરબાદી અલ્લાહ ﷻ કી નારાઝી મેં પોશીદા હૈ ઓર અલ્લાહ ﷻ કી નારાઝી ઉસ કી ઓર ઉસ કે હબીબ ﷺ કી ના ફરમાની મેં હૈ. અલ્લાહ ﷻ હમે ઈમાન કી સલામતી અતા ફરમાએ.

أَمِينٍ بِجَاكِ النَّبِيِّ الْأَمِينِ صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ

## મરે હુએ બચ્ચે કા અકીકા ?

સુવાલ 7

અગર બચ્ચા પૈદા હોને કે બા'દ સાત દિન સે પહલે પહલે ફૌત હો જાએ તો ઉસ કે અકીકે કા ક્યા કરેં ? અગર મરને કે બા'દ કર દેં તો વાલિદૈન કી શફાઅત કરેગા યા નહીં ?

જવાબ

અબ અકીકે કી હાજત નહીં એસા બચ્ચા શફાઅત કર સકેગા. મેરે આકા આ'લા હઝરત, ઈમામે અહલે સુન્નાત, મૌલાના શાહ ઈમામ અહમદ રઝા ખાન ﷺ ફરમાતે હૈં : જો મર જાએ કિસી ઉમ્મ કા હો ઉસ કા અકીકા નહીં હો સકતા, બચ્ચા અગર સાતવે<sup>7</sup> દિન સે પહલે હી મર ગયા તો ઉસ કે અકીકા ન કરને સે કોઈ અસર ઉસ કી શફાઅત વગૈરા પર નહીં, કે વોહ વક્તે અકીકા આને સે પહલે હી ગુઝર ગયા, અકીકે કા વક્ત શરીઅત મેં સાતવાં દિન હૈ. જો બચ્ચા કબ્લે બુલૂગ (યા'ની બાલિગ હોને સે પહલે) મર ગયા ઓર ઉસ કા અકીકા કર દિયા થા, યા અકીકે કી



ફરમાને મુસ્તફા ﷺ : صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : જો મુઝ પર રોઝે જુમુઆ દુરુદ શરીફ પઢેગા મેં કિયામત કે દિન ઉસ કી શફાઅત કરેગા. (કબ્રાલ)

ઈસ્તિતાઅત (તાકત) ન થી યા સાતવે દિન સે પહલે મર ગયા, ઈન સબ સૂરતોં મેં વોહ માં બાપ કી શફાઅત કરેગા જબ કે યેહ (યા'ની માં બાપ) દુન્યા સે બા ઈમાન ગએ હોં.

(ફતાવા ર-ઝવિયા, જિ. 20, સ. 596, 597)

**સુવાલ 8**

અગર કિસી ને સાતવે દિન સે કબ્લ હી બચ્ચે કા અકીકા કર દિયા તો ?

**જવાબ**

અગર્યે અકીકે કા વક્ત સાતવે રોઝ સે શુરુઅ હોતા હૈ ઓર સુન્નત વ અફઝલ યેહી હૈ તાહમ ઈસ સે કબ્લ હતા કે એક દિન કે બચ્ચે કા ભી અકીકા કર દિયા તો હો ગયા.

**બચ્ચે કે કાન મેં કિતની બાર અઝાન દેં ?**

**સુવાલ 9**

બરાએ કરમ ! યેહ ભી બતા દીજિયે કે બચ્ચા યા બચ્ચી પૈદા હો તો ઉસ કે કાન મેં અઝાન કબ ઓર કિતની બાર દેં ? બચ્ચે કા નામ કૌન સે દિન રખે ઓર સર કે બાલ કિસ દિન સાફ કરવાએં ?

**જવાબ**

જબ બચ્ચા પૈદા હો તો મુસ્તહબ યેહ હૈ કે ઉસ કે કાન મેં અઝાન વ ઈકામત કહી જાએ અઝાન કહને સે **إِنَّمَا اللهُ تَعَالَى** બલાએં દૂર હો જાએંગી. ઈમામે આલી મકામ હઝરતે સચ્ચિદુના ઈમામે હુસૈન ઈબને અલી **رَضِيَ اللهُ تَعَالَى عَنْهُمَا** સે રિવાયત હૈ કે સરકારે વાલા તબાર, હમ બે કસોં કે મદદગાર, શફીએ રોઝે શુમાર **صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ** કા ફરમાને આલીશાન હૈ : જિસ શખ્સ કે હાં બચ્ચા પૈદા હો ઉસ કે દાએં કાન મેં અઝાન ઓર બાએં કાન મેં ઈકામત કહી જાએ તો બચ્ચા ઉમ્મુસ્સિબ્યાન સે મહફૂઝ રહેગા.

(مُسْنَدُ أَبِي يَحْيَى ٦ ج ص ٣٢ حديث ١٧٤٧)

ઉમ્મુસ્સિબ્યાન કે મુ-તઅલ્લિક આશિકોં કે ઈમામ, ઈમામે

﴿يُؤْتِيكَ مِنْهَا مَتَاعًا وَأَنْتَ فِيهَا مَقْرُونٌ﴾<sup>1</sup> इरमाने मुस्तफ़ा صلى الله تعالى عليه و آله وسلم: मुज पर दुरेदे पाक की कसरत करो बेशक येह तुम्हारे लिये तदारत है. (अ-अ)

अहले सुन्नत, मुजद्विदे हीनो मिल्लत, परवानअे शम्मे रिसालत, आशिके माहे नुबुव्वत मौलाना शाह एमाम अहमद रजा पान عَلَيْهِ رَحْمَةُ الرَّحْمٰن इरमाते हैं : (सर-अ) बहुत ખબીस बला है और एसी को उम्मुस्सिब्यान कइते हैं अगर बख्यो को छो, वरना सर-अ (मिर्गी). (मह्ज्जाते आ'ला हजरत, स. 417) “नुज़्हुतुल कारी” में है : सर-अ के मा'ना बेहोश हो कर गिर पडने के हैं येह कल्मी अफ्लात<sup>1</sup> के इसाद के सबब होता है जिसे मिर्गी कइते हैं और कल्मी जिन्न या खबीस हमजाद के असर से होता है. (नुज़्हुतुल कारी, जि. 5, स. 489) मेरे आका आ'ला हजरत एमाम अहमद रजा पान عَلَيْهِ رَحْمَةُ الرَّحْمٰن इरमाते हैं : जब बख्या पैदा हो झौरन सीधे कान में अजान बाअें (उलटे) में तकबीर कहे के ख-लले शैतान व उम्मुस्सिब्यान से बये. (इतावा र-अविय्या, जि. 24, स. 452) बेहतर येह है के दहने (या'नी सीधे) कान में यार<sup>4</sup> मर्तबा अजान और बाअें (या'नी उलटे) कान में तीन मर्तबा एकामत कही जाअे. (अगर अेक मर्तबा अजान व एकामत कह दी तब ली कोई हरज नही) सातवें दिन उस का नाम रखा जाअे और उस का सर मूंडा जाअे और सर मुंडाने के वक्त अकीका किया जाअे और बालों को वज़्ज कर के उतनी यांटी या सोना स-दका किया जाअे. (बहारे शरीअत, जि. 3, स. 355)

### जल्दी नाम रचना कैसे ?

#### सुवाल 10

आप ने अभी बताया के सातवें दिन नाम रखा जाअे तो अगर किसी ने पहले या दूसरे दिन ही नाम रख लिया तो ?

الدينه

1 : अफ्लात, पलत की जम्अ. जिस्म की यार पिल्लें (1) सकरा (या'नी पित) (2) पून

(3) बलगम और (4) सौदा (जला हुवा सियाह बलगम)

इरमाने मुस्तफ़ा عَلَيْهِ السَّلَامُ : تُمْ جَلَاں بِلَى اَلو مُوُج پَر دُرْد د پَدو كے تُمْبَارَا دُرْد د مُوُج تَك پَدوَيَتَا هے. (طَرَبُ)

**जवाब**

कोई हरज नहीं.

## बख्ये के सर पर आ'इरान मलिये

**सुवाल 11**

अक्रीके में बख्ये का सर मूंडने के आ'इ सुना है सर पर आ'इरान मलना याहिये ?

**जवाब**

आप ने दुरुस्त सुना है. डरते सय्यिदुना बुरैदा  
رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ से रिवायत है, जमाने ज़ाहिलियत में  
जब हम में किसी के यहाँ बख्या पैदा होता तो वोड बकरी  
जबल करता और उस का पून बख्ये के सर पर लिथेड देता  
इर जब ईस्लाम का जमाना आया तो हम बकरी जबल  
करते थे और बख्ये का सर मुंडाते और सर पर आ'इरान  
लगाते. (ابوداؤد ج ۳ ص ۱۴۴ حدیث ۲۸۴۳)

## सर पर आ'इरान लगाने का तरीका

थोडा सा आ'इरान हस्बे ज़रत पानी में बिगो कर रभ  
दीजिये. जब नर्म हो ज़ाये तो उसी पानी में अखी तरड  
मसल दीजिये और बख्ये के मूंडे हुये सर पर लगा लीजिये.

## हर उम्र में सातवां दिन निकालने का तरीका

**सुवाल 12**

अगर सातवें दिन अक्रीका न कर सकें तो क्या हुक्म है ?

**जवाब**

कोई गुनाह नहीं. मेरे आका आ'ला डरत, ईमामे अहले  
सुन्नत, मौलाना शाह ईमाम अहमद रजा पान  
إِرْمَانَةُ عَلَيْهِ رَحْمَةُ الرَّحْمَنِ इरमाते हैं : अक्रीका विलादत के सातवें रोज

करमाने मुस्तकी صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस ने मुज पर दस भरतभा दुरदे पाक पढा अद्लाह عُزَّوَجَلَّ उस पर सो रहमते नाजिल करमाता है. (अ. ५)

सुन्नत है और येही अफ़जल है, वरना यौदहवें<sup>14</sup>, वरना  
 ठक्कीसवें<sup>21</sup> दिन. (इतावा र-अविय्या, जि. 20, स. 586)  
 सदरुशरीअह, बहरुत्तरीकह, हजरते अद्लामा मौलाना  
 मुफ़्ती मुहम्मद अमजद अली आ'जमी عَلَيْهِ رَحْمَةُ اللهِ الْقَوِي  
 इरमाते हैं : अकीके के लिये सातवां दिन बेहतर है और  
 अगर सातवें<sup>7</sup> दिन न कर सकें तो जभ याहें कर सकते हैं,  
 सुन्नत अदा हो जायेगी. बा'ज ने येह कहा के सातवें<sup>7</sup> या  
 यौदहवें<sup>14</sup> या ठक्कीसवें<sup>21</sup> दिन या'नी सात दिन का लिहाज  
 रभा जाये येह बेहतर है और याद न रहे तो येह करे के  
 जिस दिन बय्या पैदा हो उस दिन को याद रभें, उस से अेक  
 दिन पहले वाला दिन जभ आये तो वोह सातवां होगा,  
 म-सलन जुमुआ को पैदा हुवा तो जुमा'रात सातवां दिन है  
 और सनीयर (या'नी हफ़्ते) को पैदा हुवा तो सातवां दिन  
 जुमुआ होगा पहली सूरत में जिस जुमा'रात को और दूसरी  
 सूरत में जिस जुमुआ को अकीका करेगा उस में सातवें दिन  
 का हिसाब जरूर आयेगा. (बहारे शरीअत, जि. 3, स. 356)

## शाही के जानवर में अकीके की निव्यत करना कैसा ?

सुवाल 13

शाही के जानवर में बा'ज लोग दूल्हा और दीगर अफ़राह  
 के अकीके की निव्यत कर लेते हैं. क्या इस तरह अकीका हो  
 जाता है ?

जवाब

अगर जानवर कुरबानी की शराहत के मुताबिक हो और  
 कोई मानेअे शर-ई न हो तो अकीका हो जायेगा.

## गाय में कितने अकीके हो सकते हैं ?

सुवाल 14

गाय में कितने अकीके हो सकते हैं ?

इरमाने मुस्तक़ा صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस के पास मेरा जिक्र हो और वोह मुज पर दुइद शरीक न पढे तो वोह लोगों में से कजूस तरीन शप्स है. (ज़िज़ीर)

**जवाब**

ईस मुआ-मले में ईस के मसाईल कुरबानी की तरह हें लिहाजा गाय में सात हिस्से हें और यूं सात अकीके भी हो सकते हें.

### कुरबानी के जानवर में अकीके का हिस्सा

**सुवाल 15**

क्या कुरबानी की गाय में भी अकीके का हिस्सा डाल सकते हें ?

**जवाब**

छुं हां.

### बख्यों के नामों के बारे में म-दनी झूल

**सुवाल 16**

बख्ये का नाम रखने के बारे में कोई म-दनी झूल ईनायत इरमा दीजिये.

**जवाब**

सदरुशरीअह, बदरुतरीकह, हजरते अदलामा मौलाना मुइती मुहम्मद अमजद अली आ'उमी عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْقَوِي इरमाते हें : बख्ये का अख्ठा नाम रखा जाये. हिन्दूस्तान में बहुत लोगों के जैसे नाम हें जिन के कुध मा'ना नहीं या उन के बुरे मा'ना हें जैसे नामों से अहतिराज (या'नी परहेज) करें. अम्बियाये किराम الصَّلوة وَالسَّلَام عَلَيْهِمْ के अस्माये तख्यिबा और सहाबा व ताबिईन व बुरुगाने दीन (رَضَوَانِ اللَّهُ تَعَالَى عَلَيْهِمْ أَجْمَعِينَ) के नाम पर नाम रखना बेहतर है. उम्मीद है के उन की ब-र-कत बख्ये के शामिले डाल हो. (बहारे शरीअत, जि. 3, स. 356) उम्मुल मुअमिनीन हजरते सख्यि-दतुना आईशा सिदीका رَضِيَ اللَّهُ تَعَالَى عَنْهَا से रिवायत है : नबिख्ये रहमत, शकीये उम्मत, शहन्शाहे नुबुव्वत, ताजदारे रिसालत صَلَّى اللَّهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ ने इरमाया : अख्यों के नाम पर नाम रખो और अपनी हाजतें अख्ये खेडरे

फ़रमाने मुस्तक़ी صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ: उस शप्स की नाक पाक आलूद हो जिस के पास मेरा जिक्र हो और वोह मुज पर दुर्रदे पाक न पड़े. (म्)

वालों से तलब करो.

(الْفُرُؤُسُ بِمَأْثُورِ الْخَطَّابِ ج ٢ ص ٥٨ حديث ٢٣٢٩)

सदरुशरीअह, भदरुत्तरीकह, हजरते अल्लामा मौलाना मुफ़्ती मुहम्मद अमजद अली आ'जमी عَلَيْهِ رَحْمَةُ اللهِ الْقَوِي अली आ'जमी फ़रमाते हैं : अब्दुल्लाह व अब्दुर्रहमान बहुत अच्छे नाम हैं मगर इस ज़माने में येह अक्सर देखा जाता है के अब्दुर्रहमान के बजाये उस शप्स को लोग रहमान कहते हैं और गैरे जुदा को रहमान कहना हराम है. इसी तरह कसरत से नामों में तसगीर का रवाज है, या'नी नाम को इस तरह बिगाडते हैं जिस से हकारत निकलती है और जैसे नामों में तसगीर हरगिज न की जाये लिहाजा जहां येह गुमान हो, के नामों में तसगीर की जायेगी येह नाम न रभे जायें दूसरे नाम रभे जायें. (बहारे शरीअत, जि. 3, स. 356)

### मुहम्मद नाम रभने के चार इजाअल

सुवाल 17

जवाब

“मुहम्मद” नाम रभने के इजाअल ईशाद हों.

ईस ज़िम्न में चार<sup>4</sup> इराभीने सादिको अमीन صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ अर्ज करता हूँ : ﴿1﴾ जिस के लउका पैदा हो और वोह मेरी मडब्बत और मेरे नाम से ब-र-कत हासिल करने के लिये उस का नाम मुहम्मद रभे वोह (या'नी नाम रभने वाला वालिद) और उस का लउका दोनों<sup>2</sup> बिहिश्त (या'नी जन्नत) में जायें. (كُنُزُ الْعُقَالِ ج ١٦ ص ١٧٥ حديث ٤٥٢١٠) ﴿2﴾ रोजे कियामत दो<sup>2</sup> शप्स रब्बुल ईज़्जत के हुज़ूर परे किये जायेंगे. हुकूम होगा : ईन्हें जन्नत में ले जाओ. अर्ज करेंगे : ईलाही (عَزَّ وَجَلَّ) ! हम किस अमल पर जन्नत के काबिल हुये ? हम ने तो जन्नत का कोई काम किया नहीं ! फ़रमायेगा : जन्नत में जाओ, मैं ने हल्क

करमाने मुस्तफ़ी صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस ने मुज पर रोजे जुमुआ दो सो बार दुइडे पाक पढा उस के दो सो साल के गुनाह मुआफ़ डोंगे. (क्रमाल)

किया (या'नी कसम फ़रमाई) है के जिस का नाम अहमद या मुहम्मद हो दोउअम में न जायेगा. (अल्फ़ुरदौस बाम्नुअर अख़्ताब ज ०८ व ६१० हदीथ ८१३७) इतावा र-उविख्या, जि. 24, स. 687) ﴿3﴾ तुम में किसी का क्या नुकसान है अगर उस के घर में अक मुहम्मद या दो मुहम्मद या तीन मुहम्मद हों. (अल्फ़ुक्क़ातु अल्कुबुरी लाबिन सुद ज ०८ व ६०)

﴿4﴾ जब लउके का नाम मुहम्मद रभो तो उस की धुअत करो और मजलिस में उस के लिये जगह कुशादा करो और उसे बुराई की तरफ़ निस्वत न करो. (अल्जाअम अल्सुवैर लिलसुवैतु व ६९ हदीथ १०१०१)

### मुहम्मद नाम रभने की दो नियतें

भीठे भीठे ईस्लामी भाईयो ! अगर बिगैर अख़ी नियत के इकत यूं ही मुहम्मद नाम रभ लिया तो सवाब नहीं मिलेगा क्यूं के सवाब कमाने के लिये “अख़ी नियत” होना शर्त है और हदीसे पाक नम्बर 1 में दो अख़ी नियतों की सराहत (या'नी वजाहत) ली है के ताजदारे रिसालत صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ से मलुबत और आप صَلَّى اللهُ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ के नामे नामी ईस्मे गिरामी से ब-र-कत हासिल करने की नियत से मुहम्मद नाम रभने वाले फ़ुश किस्मत बाप और मुहम्मद नामी बेटे के लिये जन्नत की बिशारत है. आ'ला हजरत رَحْمَةُ اللهِ تَعَالَى عَلَيْهِ इतरत “इतावा र-उविख्या” जिल्द 24 सईहा 691 पर फ़रमाते हैं : “बेहतर येह है के सिर्फ़ मुहम्मद या अहमद नाम रभे धन के साथ “जान” वगैरा और कोई लइज न मिलाये के इजाएल तन्हा धन्ही अस्माअे मुबा-रका के वारिद हुअे

इरमाने मुस्तकी عَلَى اللَّهِ تَعَالَى عَلَيْهِ وَسَلَّمَ : मुज पर दुवुद शरीफ पढो अदलाह عَزَّوَجَلَّ तुम पर रहमत भेजेगा. (अिन सदी)

हैं.” आज कल **مَعَادُ اللَّهِ عَزَّوَجَلَّ** नाम बिगाडने की वजा आम है डालां के औसा करना गुनाह है और **मुहम्मद** नाम का बिगाडना तो बहुत ही सप्त तकलीफ़ देह है. लिहाजा अकीका में नाम **मुहम्मद** या **अहमद** रभ लीजिये और पुकारने के लिये म-सलन **बिलाल रजा, हिलाल रजा, जमाल रजा, कमाल रजा** और **जैद रजा** वगैरा रभ लिया जाये. ईसी तरह बच्चियों के नाम भी सहाबिब्यात व वलिय्यात के नामों पर रभना मुनासिब है जैसा के **सकीना, जरीना, जमीला, इतिमा, जैनब, मैमूना, मरयम** वगैरा.

### अकीके में कितने जानवर होने चाहिए ?

**सुवाल 18**

बच्चा या बच्ची के अकीके में जानवरों की ता'दाद के बारे में भी ईशाद इरमा दीजिये.

**जवाब**

लडके के लिये दो और लडकी के लिये अेक डो. मेरे आका आ'ला डजरत, ईमामे अहले सुन्नत, मौलाना शाह ईमाम अहमद रजा **أَنَّ عَلَيْهِ رَحْمَةَ الرَّحْمَنِ** इरमाते हैं : (दोनों के लिये) कम से कम अेक (अेक जानवर) तो है ही और पिसर (या'नी बेटे) के लिये दो (जानवर) अफ़जल हैं (बेटे के लिये दो की) ईस्तिताअत (या'नी ताकत) न डो तो अेक भी काफ़ी है. (इतावा र-उबिय्या, जि. 20, स. 586)

### अकीके का जानवर कैसा हो ?

**सुवाल 19**

अकीके का जानवर कैसा होना चाहिए ?

**जवाब**

अेक कस्साब से अकीके के लिये जानवर खरीदने के मु-तअद्लिक किये गअे अेक सुवाल के जवाब में मेरे आका



इरमाने मुस्तफा صلى الله تعالى عليه وآله وسلم : मुज पर कसरत से दुरदे पाक पढे बेशक तुम्हारा मुज पर दुरदे पाक पढना तुम्हारे गुनाहों के लिये मज्किरत है. (मुज)

आ'ला उजरत رَحْمَةُ اللَّهِ تَعَالَى عَلَيْهِ इरमाते हैं : एन उमूर में अहकामे अकीका भिस्ले कुरबानी हैं, आ'जा सलामत हों, बकरा बकरी ऐक साल से कम की ज़रत नहीँ, भेड, भेंढा छ<sup>6</sup> महीने का भी हो सकता है जब के एतना ताजा व इरबा हो के साल भर वालों में भिला हें तो दूर से मु-तमय्यज न हो (या'नी देभने में साल भर का नजर आये) (इतावा २-जविय्या, जि. 20, स. 584) अकीके के जानवर के मु-तअद्लिक उजरते अद्लामा शाभी قَدَسَ سِرُّهُ السَّامِي इरमाते हैं, “बदाअेअ” में है : अइजल कुरबानी येह है के भेंढा, यितकुब्रा, सींगों वाला और पस्सी हो. (०६१० १८ १८)

### जानवर की उम्र में शक हो तो ?

सुवाल 20

अकीका या कुरबानी के जानवर की उम्र में शक हो तो क्या करना चाहिये ? لأن علم العلم بتحقيق الشرط كعلم العلم

जवाब

उम्र कम होने का शुभा हो तो उस जानवर की कुरबानी या अकीका न करे. इस जिम्न में इतावा २-जविय्या जिल्द 20 सफ़हा 583 और 584 से दो<sup>2</sup> जूज्ठयात मुला-हजा हों : ﴿1﴾ साल भर से कम की बकरी अकीके या कुरबानी में नहीँ हो सकती, अगर भश्कूक डालत है तो वोह भी ऐसी ही है के साल भर की न होना मा'लूम हो, (शर्त के पाअे जाने का एल्म

न होना ऐसे ही है जैसे उस यीज के न होने का एल्म हो) ﴿2﴾ जब के साल भर कामिल होने में शक है तो उस का अकीका न करे और (जानवर बेयने वाले) कस्साब का कौल यहां काई नहीँ के (जानवर) भिकने में इस (या'नी बेयने वाले)

करमाने मुस्तक। عَنِ اللَّهِ تَعَالَى عَلَيْهِ وَسَلَّمَ : जो मुठ पर अक दुइद शरीक पढता हे अदलाउ उर उस के लिये अक कीरात अज लिभता हे और कीरात उदुद पडाउ जितना हे. (मुराज)

का नफ़अ हे और (साल भर का बय्या जो दांत तोड़ता है वोह ईस ने अभी न तोड़े येह) डालते जाहिरा ईस (बेयने वाले) की बात (या'नी जानवर कामिल होने के दा'वे) को दफ़अ कर रही है. وَاللَّهُ تَعَالَى أَعْلَمُ. (जुलासअे कलाम येह है के अगर जानवर की उम्र पर येह शक हो के येह बकरा साल भर का नहीं मा'लूम होता या गाय शायद दो<sup>2</sup>साल से कम उम्र की है तो औसी मश्कूक डालत में उस जानवर की कुरबानी या अकीका नहीं हो सकता)

## अकीके के गोशत की तकसीम का मसअला

सुवाल 21

अकीके के गोशत की तकसीम किस तरह करे ?

जवाब

मेरे आका आ'ला हजरत, ईमामे अहले सुन्नत, मौलाना शाह ईमाम अहमद रजा भान عَلَيْهِ رَحْمَةُ الرَّحْمٰن करमाते हैं : (अकीके का) गोशत ली भिस्वे कुरबानी तीन हिस्से करना मुस्तहब है, अक अपना, अक अकारिब, अक मसाकीन का और याहे तो सब जा ले ज्वाह सब बांट दे, जैसे कुरबानी. (इतावा २-जविय्या, जि. 20, स. 584)

## पका कर भिलाओं या कय्या बांटें ?

सुवाल 22

अकीके का गोशत पका कर भिलाना अइजल है या कय्या गोशत तकसीम कर दें ?

जवाब

पका कर भिलाना कय्या तकसीम करने से अइजल है.

(अेज्ज)

## अकीके का गोशत मां बाप जा सकते हैं या नहीं ?

सुवाल 23

क्या अकीका के गोशत में वालिदैन का ली हिस्सा है ?

करमाने मुस्तफ़ा عَلَى اللَّهِ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ जिस ने किताब में मुज पर दुरुदे पाक लिखा तो जब तक मेरा नाम उस में रहेगा फिरिश्ते उस के लिये ईस्तिग्फ़ार करते रहेंगे. (उं. ७)

**जवाब**

यू तो किसी का ल्मी हिस्सा ज़रूरी नहीं, अलबत्ता मुस्तहब तक्सीम का बयान हो चुका. येह जो मशहूर है के वालिदैन नहीं जा सकते येह गलत बात है. मां बाप, दादा दादी, नाना नानी वगैरा सभी मुसल्मान जा सकते हैं.

### काफ़िरा दाई से जयगी करवाना हराम है

**सुवाल 24**

कहते हैं के अक्रीके के गोश्त में से नाई को सर और दाई (Midwife) को रान देना याहिये और अगर दाई काफ़िरा हो तो क्या करे ?

**जवाब**

मेरे आका आ'ला हज़रत, ईमामे अहले सुन्नत, मौलाना शाह ईमाम अहमद रज़ा जान عَلَيْهِ رَحْمَةُ الرَّحْمَنِ इतावा र-जविय्या जिल्द 20 सफ़्हा 588 पर इरमाते हैं : सर नाई को देने का न कहीं हुकम न मुमा-न-अत, ओक रवाज (या'नी रस्मो रवाज की) बात है, (देने में हरज नहीं) जनाई (Midwife) को रान देने का हुकम अलबत्ता हदीस से (साबित) है, मगर काफ़िरा से येह (या'नी जयगी का) काम लेना हराम. काफ़िरा से मुसल्मान औरत को जैसे ही पर्दे का हुकम है जैसे मर्द से के सिवा मुंह की टिकली और हथेलियों और तलों के कुछ न दिजाये, न के पास जनाई (या'नी जयगी) का काम. "रदुल मुहतार" में है : "मुसल्मान औरत को यहूदी या नसरानी या मुश्रिक औरत के सामने नंगा होना हलाल नहीं सिवाये इस के, के वोह इस की लौंडी हो." (रदुल मुहतार १८३) आ'ला हज़रत عَلَيْهِ رَحْمَةُ اللَّهِ تَعَالَى मज़ीद इरमाते हैं : फिर अगर किसी

करमाने मुस्तकी : صلى الله تعالى عليه و آله وسلم : जिस ने मुज पर अक बार दुर्रुद पाक पढा अल्लाह उस पर दस रकमतों भेजता है. (स्)

ने अपनी हमाकत से ँस (या'नी काफ़िरा से डिलीवरी करवाने के) गुनाह का ँरतिकाभ किया, **أَوْ كَانَ صَاحِبُ الْأَضْطَرَارِ إِلَيْهِ**, (या'नी या ँस की सहीह शदीह मजबूरी हो) तो उस (काफ़िरा) को रान वगैरा कुछ न दें के काफ़िरों का स-दकात वगैरा में कुछ हक नहीं न उस को देने की (शरअन) ँजाजत. (इतावा र-अविथ्या, जि. 20, स. 588, 589) सईहा 588 पर ँस से पिछले इतवे में ँशाद इरमाते हैं : भंगन या किसी काफ़िरा को जनाई (Midwife) बनाना सप्त हराम है. न काफ़िरा को रान दी जाये और बालों की यांटी मिसकीन का हक है, नाई मिसकीन हो तो देने में मुजा-यका नहीं, अस्ल हुकम येह है इर जिस ने ँस के भिलाइ किया भंगन को रान, गनी नाई को यांटी दी तो बुरा किया मगर अकीका हो गया. सिरि के बारे में कोई भास हुकम नहीं जिसे याहे दे, जिस का अकीका न हुवा हो वोह जवानी, बुढापे में भी अपना अकीका कर सकता है. **والله تعالى أعلم**

## अकीके की भाल का इस्ति'माल

सुवाल 25

जवाब

अकीके के जानवर की भाल का क्या हुकम है ?

ँस के गोशत और भाल का भी वोही हुकम है जो कुरबानी के जानवर के गोशत पोस्त (भाल) का, के भाल को बाकी रभते हुये या अैसी चीज से बदल कर जिसे बाकी रभ कर नईअ उठाया जा सकता हो अपने सई में लाये या मिसकीन को दे या किसी और नेक काम म-सलन मस्जिद या मद्रसे में सई करे.

(अडारे शरीअत, जि. 3, स. 357)

ફરમાને મુસ્તફા ﷺ : عَلَى اللَّهِ تَعَالَى عَلَيْهِ وَالْوَسْمُ : જો શબ્સ મુઝ પર દુરુદે પાક પઢના ભૂલ ગયા વોહ જન્નત કા રાસ્તા ભૂલ ગયા. (ખૂબ)

## ખાલ ઉજરત મેં દેના કેસા ?

**સુવાલ 26** કયા કસ્સાબ કો અકીકે કે જાનવર કી ખાલ બતોરે ઉજરત દે સકતે હેં ?

**જવાબ** નહીં દે સકતે. (ઐઝન, સ. 346) ઈસી તરહ નાઈ કો સર યા જનાઈ (Midwife) કો રાન બતોરે ઉજરત દેને કી શરીઅત મેં ઈજાઝત નહીં.

## કૌન ઝબ્હ કરે ?

**સુવાલ 27** અકીકે કા જાનવર કૌન ઝબ્હ કરે ?

**જવાબ** મેરે આકા આ'લા હઝરત, ઈમામે અહલે સુન્નત, મૌલાના શાહ ઈમામ અહમદ રઝા ખાન عَلَيْهِ رَحْمَةُ الرَّحْمٰن ફરમાતે હેં : બાપ અગર હાઝિર હો ઔર ઝબ્હ પર કાદિર હો તો ઉસી કા ઝબ્હ કરના બેહતર હે કે યેહ શુકે ને'મત હૈ, જિસ પર ને'મત હુઈ વોહી અપને હાથ સે શુક અદા કરે. વોહ ન હો યા ઝબ્હ ન કર સકે તો દૂસરે કો ઈજાઝત દે દે.

(ફતાવા ર-ઝવિયા, જિ. 20, સ. 585 મુલખખસન)

## અકીકે કી દુઆ

**સુવાલ 28** અકીકે કી દુઆ કૌન પઢે ? ઝાબેહ યા વાલિદ ?

**જવાબ** ઝાબેહ યા'ની જો ઝબ્હ કરે વોહી દુઆ પઢે. અકીકએ પિસર (લડકે કે અકીકે) મેં, કે બાપ ઝબ્હ કરે (તો ઝબ્હ સે કબ્લ) દુઆ યું પઢે :

करमाने मुस्तफ़ी: عَلَى اللَّهِ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ: जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुरुददे पाक न पढ़ा तबकीक वो लु बढ भप्त हो गया. (उत्त)

اللَّهُمَّ هَذِهِ عَقِيْقَةُ ابْنِي فَلَانٍ دَمُهَا  
بِدَمِهِ وَلَحْمُهَا بِالْحَمِهِ وَعَظْمُهَا  
بِعَظْمِهِ وَجِلْدُهَا بِجِلْدِهِ وَشَعْرُهَا  
بِشَعْرِهِ ط اللَّهُمَّ اجْعَلْهَا فِدَاءً لِابْنِي  
مِنَ النَّارِ بِسْمِ اللَّهِ الْكَبِيْرِ۔

ऐ अल्लाह! ये लु मेरे कुलां बेटे का अकीका है, इस का पून उस के पून, इस का गोशत उस के गोशत, इस की लडी उस की लडी, इस का यमडा उस के यमडे और इस के बाल उस के बाल के बढले में हें. ऐ अल्लाह! इस को मेरे बेटे के लिये जलन्म की आग से इंदया बना दे. अल्लाह तआला के नाम से, अल्लाह सब से बडा है.

(दुआ भत्म कर के कौरन जलु कर दे)

कुलां की जगलु पिसर (या'नी बेटे) का जो नाम हो, ले, दुपतर (या'नी बेटी) हो तो दोनों जगलु **ابْنِي** की जगलु और पांथों जगलु **ها** की जगलु कले और दूसरा शप्स जलु करे तो दोनों जगलु **فُلَانٍ** या **بْنِي فُلَانٍ** की जगलु **فُلَانٍ** या **فُلَانٍ** या **بْنِي فُلَانِهِ** कले. बय्ये को इस के बाप की तरफ़ निस्भत करे. (इतावा र-जविथ्या, जि. 20, स. 585) म-सलन मुहम्मद रजा बिन मुहम्मद अली.

**क्या दुआ पढना जरूरी है ?**

**सुवाल 29**

क्या दुआ पढे बिगैर अकीका नहीं होगी ?

**जवाब**

बिगैर दुआ पढे जलु करने से भी अकीका हो जायेगा.

(बहारे शरीअत, जि. 3, स. 357)

**अकीके के गोशत की हड्डियां तोडना कैसा ?**

**सुवाल 30**

क्या ये लु दुरुस्त है के अकीके के जानवर की लड्डियां न तोडी जायें ?

કરમાને મુસ્તકા عَنِ اللَّهِ تَعَالَى عَلَيْهِ وَآلِهِ وَسَلَّمَ : जिस ने मुज पर ओक बार दुइटे पाक पढा अदलाह उस पर दस हुमतें भेजता है. (स्)

**જવાબ**

બેહતર યેહ હૈ કે ઈસ કી હડી ન તોડી જાએ બલકે હડિયોં પર સે ગોશત ઉતાર લિયા જાએ યેહ બચ્ચે કી સલામતી કી નેક ફાલ હૈ ઓર હડી તોડ કર ગોશત બનાયા જાએ ઈસ મેં ભી હરજ નહીં. (એઝન)

## મીઠા ગોશત

**સુવાલ 31**

કયા અકીકે કા ગોશત પકાને કા ભી કોઈ મખ્સૂસ તરીકા હૈ ?

**જવાબ**

સદરુશરીઅહ, બદરુત્તરીકહ, હઝરતે અલ્લામા મૌલાના મુફ્તી મુહમ્મદ અમજદ અલી આ'ઝમી عَلَيْهِ رَحْمَةُ اللَّهِ الْقَوِي ફરમાતે હેં : ગોશત કો જિસ તરહ ચાહેં પકા સકતે હેં મીઠા પકાયા જાએ તો બચ્ચે કે અપ્લાક અચ્છે હોને કી ફાલ હૈ. (એઝન) મીઠા ગોશત બનાને કે દો<sup>2</sup> તરીકે : ﴿1﴾ એક કિલો ગોશત, આધા કિલો મીઠા દહી, સાત દાને છોટી ઈલાયચી, 50 ગ્રામ બાદામ, હસ્બે ઝરૂરત ઘી યા તેલ સબ મિલા કર પકા લીજિયે, પકને કે બા'દ ઝરૂરત કે મુતાબિક યાશની ડાલિયે. ઝીનત (યા'ની ખૂબ સૂરતી) કે લિયે ગાજર કે બારીક રેશે બના કર નીઝ કિશમિશ વગૈરા ભી ડાલે જા સકતે હેં ﴿2﴾ એક કિલો મેં આધા કિલો ચુકન્દર ડાલ કર હસ્બે મા'મૂલ પકા લીજિયે.

**સુવાલ 32**

અકીકે કે મૌકઅ પર જો તહાઈફ દિયે જાતે હેં યેહ કેસા હૈ ?

**જવાબ**

આજ કલ ઉમૂમન અકીકે કે લિયે તઆમ (યા'ની ખાને) કા એહતિમામ કર કે અઝીઝો અકારિબ કો દા'વત દી જાતી

ફરમાને મુસ્તફા ﷺ : જો શપ્સ મુઝ પર દુરૂદે પાક પઢના ભૂલ ગયા વોહ જન્નત કા રાસ્તા ભૂલ ગયા. (ખીરુલ)

હે જો કે અચ્છા કામ હૈ ઓર દા'વત પર આને વાલે મેહમાન, બચ્ચે કે લિયે તોહફે લાતે હૈં યેહ ભી ખૂબ હૈ. અલબત્તા યહાં કુછ તફ્સીલ હૈ : અગર મેહમાન કુછ તોહફા ન લાએ તો બા'ઝ અવકાત મેઝબાન યા ઉસ કે ઘર વાલે મેહમાન કી બુરાઈ કરને કે ગુનાહોં મેં પડતે હૈં, તો જહાં યકીની તૌર પર યા ઝન્ને ગાલિબ સે ઐસી સૂરતે હાલ હો વહાં મેહમાન કો ચાહિયે કે બિગૈર મજબૂરી કે ન જાએ, ઝરૂરતન જાએ ઓર તોહફા લે જાએ તો હરજ નહીં, અલબત્તા મેઝબાન ને ઈસ નિચ્ચત સે લિયા કે અગર મેહમાન તોહફા ન લાતા તો યેહ યા'ની મેઝબાન ઈસ (મેહમાન) કી બુરાઈયાં કરતા, યા બતૌરે ખાસ નિચ્ચત તો નહીં મગર ઈસ (મેઝબાન) કા ઐસા બુરા મા'મૂલ હૈ તો જહાં ઈસે (યા'ની મેઝબાન કો) ગાલિબ ગુમાન હો કે લાને વાલા ઈસી તૌર પર યા'ની (મેઝબાન કે) શર સે બચને કે લિયે લાયા હૈ તો અબ લેને વાલા મેઝબાન ગુનહગાર ઓર અઝાબે નાર કા હકદાર હૈ ઓર યેહ તોહફા ઈસ કે હક મેં રિશ્વત હૈ. હાં અગર બુરાઈ બયાન કરને કી નિચ્ચત ન હો ઓર ન ઈસ કા ઐસા બુરા મા'મૂલ હો તો તોહફા કબૂલ કરને મેં હરજ નહીં.

**નોટ :** યેહ રિસાલા પહલી બાર માહે શૈખ અબ્દુલ કાદિર 7 રબી'ઉલ આખિર 1428 સિ.હિ. બ મુતાબિક 25-4-2007 કો તરતીબ પાયા ઓર કઈ બાર શાએઅ કિયા ગયા ફિર 5 ઝુલ કા'દતિલ હરામ 1433 સિ.હિ. બ મુતાબિક 23-9-2012 મેં ઈસ પર



करमाने मुस्तफ़ी صلى الله تعالى عليه وآله وسلم: जिस के पास मेरा जिक्र हुआ और उस ने मुझ पर दुर्दे पाक न पड़ा तबकीक वोह बढ भप्त हो गया. (उ.न.)

नजरे सानी की.

अेक युप सो<sup>100</sup> सुभ

तालिबे गमे मदीना व  
अकीअ व मकिरत व  
बे हिसाब जन्मतुल  
किरदौस में आका  
का पडोस



5 जुल का'दतिल हराम 1433 सि.हि.

23-9-2012

आखडमराज

मطبूरे	क़ाब	मطبूरे	क़ाब
दारअल्फ़ीरोत	मज्जअलअरवाक	दारअहियाअलअरथअल्फ़ीरोत	अबुआद
दारअल्फ़ीरोत	अल्फ़ीरोतअल्फ़ीरोत	दारअल्फ़ीरोत	अरुदी
क़ोत	अल्फ़ीरोत	दारअल्फ़ीरोत	अबनमाजे
फ़रीदकअशलमरकअलअदुलअलामोर	अरुदी	दारअल्फ़ीरोत	मस्जिदअबुअररुफ़
दारअल्फ़ीरोत	रुदअल्फ़ीरोत	दारअहियाअलअरथअल्फ़ीरोत	मज्जअलअरुदी
रुदअल्फ़ीरोत	फ़ादुअरुदुअल्फ़ीरोत	दारअल्फ़ीरोत	मस्जिदअबुअरुदुअल्फ़ीरोत
मस्जिदअल्फ़ीरोत	अहियाअल्फ़ीरोत	दारअल्फ़ीरोत	अल्फ़ीरोतअल्फ़ीरोत
मस्जिदअल्फ़ीरोत	अल्फ़ीरोतअल्फ़ीरोत	दारअल्फ़ीरोत	अल्फ़ीरोतअल्फ़ीरोत
मस्जिदअल्फ़ीरोत	अल्फ़ीरोतअल्फ़ीरोत	दारअल्फ़ीरोत	अल्फ़ीरोतअल्फ़ीरोत

क़ेडरिस

उन्वान	संख़ा	उन्वान	संख़ा
अकीका के मा'ना	2	मुहम्मद नाम रअने की दो नुय्यते	13
क्या अकीका न करना गुनाह है?	3	अकीके में कितने ज़ानवर होने थालेअें?	14
बेअकीका मरने वाला अख्या शफ़अत करेगा या नही?	4	अकीके का ज़ानवर कैसा हो?	14
कख्या अख़ गिर जाने की क़ज़ीवत	5	ज़ानवर की उम्र में शक़ हो तो?	15
मरे हुअे अख़े का अकीका?	6	अकीके के गोशत की तक़सीम का मख़अला	16
अख़े के कान में कितनी बार अज़ान हें?	7	पका कर अिलाअें या कख्या आंटे?	16
जल्दी नाम रअना कैसा?	8	अकीके का गोशत मां बाप आ सकते हें या नही?	16
अख़े के सर पर अज़ा'फ़रान मलिये	9	काफ़िरा दाई से अज़गी करवाना हराम है	16
सर पर अज़ा'फ़रान लगाने का तरीका	9	अकीके की पाल का ठस्ति'माल	18
हर उम्र में सातवां दिन निकावने का तरीका	9	पाल अज़रत में देना कैसा?	18
शादी के ज़ानवर में अकीके की नुय्यत करना कैसा?	10	कौन अख़ करे?	18
गाय में कितने अकीके हो सकते हें?	10	अकीके की दुआ	19
कुरआनी के ज़ानवर में अकीके का अख़िस्सा	11	क्या दुआ पढना अज़री है?	20
अख़ों के नामों के बारे में म-दनी क़ूल	11	अकीके के गोशत की अख़ियां तोअना कैसा?	20
मुहम्मद नाम रअने के यार क़ज़ा'ल	12	भीठा गोशत	20

## सुन्नत की बहारें

اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِیْنَ तब्दीने कुरआनो सुन्नत की आवमगीर गैर सियासी तहरीक हा'वते ईस्लामी के मडके मडके म-दनी माडोल में अ कसरत सुन्नतों सीधी और सिधाई खती हैं, हर जुमा'रात ईशा की नमाज के आ'द आप के शहर में खोने वाले हा'वते ईस्लामी के हक़्तावार सुन्नतों भरे ईजतिमाअ में रिज़ाअे ईलाही के लिये अच्छी अच्छी नियतों के साथ सारी रात गुज़रने की म-दनी ईस्तिज़ा है. आशिकाने रसूल के म-दनी काफ़िलों में अ नियते सवाअ सुन्नतों की तरबियत के लिये सकर और रोज़ाना किके मदीना के जरीअे म-दनी ईन्आमात का रिखावा पुर कर के हर म-दनी माड के ईप्तिदाई दस दिन के अन्दर अन्दर अपने पहां के जिम्मेदार की जम्अ करवाने का मा'भूल बना लीजिये, اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِیْنَ ईस की अ-र-कत से पाबन्दे सुन्नत बनने, गुनाहों से नकरत करने और ईमान की छिकाजत के लिये कुठने का जेहूअ बनेगा.

हर ईस्लामी भाई अपना येह जेहूअ बनाअे के "भुजे अपनी और सारी दुन्या के लोगों की ईस्लाह की कोशिश करनी है. اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِیْنَ" अपनी ईस्लाह की कोशिश के लिये "म-दनी ईन्आमात" पर अमल और सारी दुन्या के लोगों की ईस्लाह की कोशिश के लिये "म-दनी काफ़िलों" में सकर करना है. اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعَالَمِیْنَ



### मड-त-अतुल मदीना की शांभें

- सुरत : वलिया भाई मस्जिद के सामने, ज्वाज़ हांना हरगाह के पास, सुरत.
- जमनगर : पांग हाटडी, जमनगर.
- भोडासा : सुका बाज़ार, भोडासा.
- गांधीधाम: सपना नगर, मदीना मस्जिद के पास, गांधीधाम.
- धोलका : ताजदारे मदीना मस्जिद के सामने, टावर बाज़ार, धोलका.
- अरोडा : कासिम हावा मस्जिद, नागर वाडा, अरोडा.

### मड-त-अतुल मदीना

हा'वते ईस्लामी

مکتبۃ الدین

ईजाने मदीना, श्री डोनिया बगीचे के सामने, मिरज़ापुर, अहमदशाहाद, मुजरात, हन्डिया  
Mo.091 93271 68200 E-mail : maktabaahmedabad@gmail.com www.dawateislami.net